

રાજકોટ ગ્રામ્ય જિલ્લા:- પોલીસે કરેલ સારી કામગીરી

તા.૧૭/૦૯/૧૮ થી તા.૨૩/૯/૨૦૧૮

**1. જુગારનો ગણનાપાત્ર કેસ ઉપલેટા પોલીસ સ્ટેશન**

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબના હુકમથી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જે.એમ.ભરવાડ સાહેબની રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ ઉપલેટા પો.સ્ટે ના પો.ઇન્સ શ્રી એચ.જી.પલ્લાયર્ચા સાહેબ તથા પો.હેડ.કોન્સ કીશોરભાઈ શ્યારા તથા ભાવેશભાઈ બોરીયા તથા શકિતસિંહ જાડેજા તથા નિલેશભાઈ ચાવડા પો.કોન્સ. જયેશભાઈ દાફડા તથા કુલદીપસિંહ જાડેજા એમ બધા ઉપલેટા પો.સ્ટે વિસ્તારમાં ના.રા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઉપલેટા બડાબજરંગ રોડ યાદેશ્વર ચોકમાં આવેલ જય વડવાળા ડેરી પાસે આરોપીઓ (૧) સંજયભાઈ હિરાભાઈ ચાવડા જાતે આહીર ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.ઉપલેટા વિજળી રોડ રઘુવિર બંગલા પાસે (૨) વિપુલભાઈ વજુભાઈ ચંદ્રવાડીયા જાતે આહીર ઉ.વ.૩૨ ધંધો વેપાર રહે.ઉપલેટા બડા બજરંગ રોડ, યાદેશ્વર પાન પાસે (૩) મેહુલભાઈ ભીખાભાઈ વસરા જાતે આહીર ઉ.વ.૩૩ રહે. ઉપલેટા બડા બજરંગ રોડ, યાદેશ્વર પાન પાસે વાળા જાહેરમાં ત્રીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ગંજીપાનાના પાના કી રૂ ૦૦/૦૦ તથા રોકડ રૂપીયા ૨૪૩૬૦/-નાં મુદામાલ સાથે મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

**2. દેશીબનાવટ ની લોડેડ પીસ્ટલ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમ**

પોલીસ અધિક્ષક સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય રાજકોટ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબ સાથે પો.સબ.ઇન્સ વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા સંજયભાઈ નિરંજની તથા પો.કોન્સ દિનેશભાઈ ગોંડલીયા તથા રણજીતભાઈ ધાંધલ તથા ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા દિલીપસિંહ જાડેજા એમ બધા એસ. ઓ.જી.કામગીરી તથા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન SGST ના અધિકારી ગોંડલ ગ્રીન સોસાયટી બ્લોક નંબર-૩ માં GST કામગીરીમાં હતા તે દરમ્યાન દેશીબનાવટ ની લોડેડ પીસ્ટલ મળી આવતા તેની જાણ એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબ ને કરતા તુરતજ તે જગ્યાએ પહોંચી એક દેશી બનાવટની પીસ્ટલ કી.રૂ.૧૦૦૦૦/- તથા પાંચ જીવતા કારટીસ કિ. રૂ.૨૫૦/- તથા એક ખાલી કારટીસ કિ. રૂ.૦૦/- ગણી તપાસ અર્થે હથિયાર તેમજ કારટીસ કબ્જે કરી બ્લોક નંબર-૩ ના કબ્જા ભોગવતા વાળા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

3. જેતપુર માહીર એપાર્ટમેન્ટ માં જુગાર નો અખાડો પકડી પાડતી જેતપુર સિટી પોલીસ...

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ ની સૂચનાથી જેતપુર Dysp શ્રી જે.એમ.ભરવાડ સાહેબ તથા જેતપુર સિટી પો.સ્ટે.પા શ્રી વી.આર.વાણિયા સાહેબ તથા HC સંજયભાઈ પરમાર તથા pc ચેતનભાઈ ઠાકોર તથા pc લાખુભા રાઠોડ તથા Pc વિશાલભાઈ સોનારા જેતપુર સિટી વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે દરિમયાન HC સંજયભાઈ પરમાર તથા PC ચેતનભાઈ ઠાકોર ને મળેલી હકીકત આધારે જેતપુર જુથુંડી રોડ પર આવેલ માહીર એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૧૧ માં જુગાર રમતા ૭ શખ્સો ને જેતપુર સિટી પોલીસે ઝડપી પાડ્યા જેમા આરોપી (૧) વિશાલભાઈ નિલેષભાઈ મારુ જાતે કડીયા ઉવ ૨૭ (૨) આનંદભાઈ ગીરીશભાઈ સાતા જાતે લુવાણા ઉ.વ.૩૦ (૩) દેવેન્દ કનૈયાલાલ ખુવા જાતે સીંધી ઉ.વ.૨૭ (૪) પ્રફુલભાઈ જેન્તીભાઈ ગઢીયા જાતે લુવાણા ઉ.વ.૩૦ (૫) મનસુખભાઈ દેવશીભાઈ સોલંકી જાતે ઘોબી ઉવ.૫૦ (૬) જયેશભાઈ નિલેષભાઈ મારુ જાતે ઉ.વ.૨૨ (૭) કપીલભાઈ દયારામભાઈ જાતે બાવાજી ઉ.વ.૨૫ રહે તમામ જેતપુર વાળાઓને રોકડ રૂ.૭૫,૬૫૦/નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૪.૫.મુજબ નો ગુન્હે નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.....

4. પતા પ્રેમી પાકડી પાડતી ગોંડલ તાલુકા પોલીસ

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ તથા નાયબ પો.અધિક્ષક સાહેબ ડી.એમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ વિસ્તારમાં જુગારની બંદિને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેથી એ.વી. જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ ગોંડલ તાલુકા પો.સ્ટે.વિસ્તાર માં હડમતાડા ગામની સીમમાં આવેલ રામાપીર ના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ૬ પતા પ્રેમી પાસેથી રોકડ રૂ.-૪૩,૦૦૦/- પંચનામાની વિગતે કબ્જે કરી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કારેલ છે.આ કામગીરી માં ગોંડલ તાલુકા પો.સ્ટે.ના પો.હેડ. કોન્સ. જે.વી.વાળા પો.હેડ.કોંસ.કે.કે. ગઢવી તથા પો.કોંસ.દિગુભા ઝાલા તથા પો.કો. પ્રકાશભાઈ એન.પરમાર જોડાયેલ હતા.

5. જેતપુર તાલુકા પો.સ્ટે.માં ચાર મહીના પહેલા ખીરસરા ગામે અસ્થીર મગજની મહીલા પર આચરેલ દુષ્કર્મ કેશના અનડીટેક ગુન્હાના આરોપી ને શોધી કાઢતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર વિભાગ તથા જેતપુર તાલુકા પોલીસની ટીમ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબનાઓ તરફથી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માથી બનેલ અનડિટેક્ટ ગુંહાઓ શોધી કાઢવા માળેલ સુચના અનુસંધાને શ્રી ના.પો. અધીશ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર નાઓના સિધા માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૩૧/૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)જે.એલ. તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ બનેલ અનડિટેક બનાવ અનુસંધાને શ્રી પો.સ.ઇ. એચ.એ.જાડેજા સાહેબ દ્વારા શંકમંદો ના ડી.એન.એ. નમુના લેવડાવી ગાંધીનગર એફ.એસ.એલ. ખતે મોકલવામા આવેલ જેમા એફ.એસ.એલ. ગાંધીનગર દ્વારા કરવામા આવેલ પરીક્ષણ મા શકમંદ કમલેશ

કુરજીભાઇ કંડોલીયા જાતે ખાંટ રહે ખીરસરા તા.-જેતપુર વાળાનુ સેમ્પલ પોઝીટીવ આવેલ અને જન્મ થનાર બાળકના બાયોલોજીકલ ફાઇર તરીકે તે પુરવાર થતા હોય સદરહુ અનડિટેક્ટ ગુન્હો શોધી કાઢી ગુન્હો એટ્રોસીટી એક્ટ મુજબ બનતો હોય આગળ ની કાર્યવાહી ના.પો.અધી. સા. એસ.સી./એસ.ટી. સેલ નાઓ ચલાવી રહેલ છે.આ કામગીરી માં નાયબ પોલીસ શ્રી જે.એમ.ભરવાડ સાહેબ તથા પો.સ.ઇ. એચ.એ. જાડેજા તથા પો.સ.ઇ. પી.જે.ખાંટવા તથા પો.હેડ.કોન્સ. ભુરાભાઇ માલીવાડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ. નીલેશભાઇ ડાંગર તથા પો.કોન્સ. વીશાલભાઇ સોનેરા સામેલ હતા.